

જોખમી વિસ્તારમાં ઈલેક્ટ્રીકલ સાધનો

ઓક્ટોબર - ૨૦૧૩

એકસો વર્ષ પહેલાં, ૧૪ ઓક્ટોબર ૧૯૧ ઉને દિવસે, સાઉથ વેલ્સ, ગ્રેન્ભોર્ડનના સેન્ચેન્ડમાં ઘડાકાથી રૂટલ લોકો મૃત્યુ પામ્યા. ઈંગ્લેન્ડના ઇતિહાસમાં કોલસાના ખાણાની આ સૌથી ભયાનક હોનારત હતી. એવુ માનવામાં આવે છે કે આ અક્સમાત મિથેન ગેસ (ફિયર ડિપ્પ) સાધનના ઈલેક્ટ્રીક સ્પાર્કથી સળગવાથી થયો હતો, સંભવિત ઈલેક્ટ્રીક બેલના સીનલથી. ગેસના ઘડાકાથી કોલસાની ધૂળ ખાણામાં ઉડી, જેનાથી કોલસાની ધૂળનું વાદળ બન્યુ જે સળગ્યું. આ વાદળીય ઘડાકાથી બીજી વધારે કોલસાની ધૂળ ઉડી અને જેનાથી એક પછી એક ઘડાક ચાલુ થયા.



આ સેન્ચેન્ડ ઘડાકાઓની ઘટનાથી એવુ ફળભૂત થયુ કે જીવલનશીલ વરાળ, ધૂળ અથવા જાકળીય વાદળને ઈલેક્ટ્રીકલ સાધનોના સ્પાર્કથી સળગવાની સંભાવનાનું જોખમ રહેલું છે. આંતરિક સુરક્ષિત સાધનો વાપરવા એ એક સંરક્ષણાત્મક અભિગમ છે તેને આ રીતે વ્યાખ્યાપિત કરી શકાય કે “ખૂબ જલ્દીથી સળગી શકે તેવા જોખમી વાતાવરણીય મિશ્રણના સંમશ્રણને સામાન્ય અથવા અસમાન્ય પરિસ્થિતિમાં સાધનો અને વાયરો પર્યાપ્ત ઈલેક્ટ્રીકલ અથવા થર્મલ શક્તિ બહાર કાઢવા સક્ષમ નથી”. ઈલેક્ટ્રીકલ સાધનોની ચોક્કસ ડિઝાઇન દ્વારા આ રીતે મેળવી શકાય છે. દા.ત.: ઈલેક્ટ્રીકલ સાધનોને પાવરની માત્રા એટલી ઓછી આપવી કે જે જોખમી વાતાવરણ વિસ્તારમાં બળતણના મિશ્રણને સળગવા જરૂરી માત્રાથી ઓછી હોય.

જોખમી વિસ્તારમાં ઈલેક્ટ્રીક સુરક્ષા ઉપરનું ઊડાણપૂર્વકની ચર્ચા એ આ બેકનના કાર્યક્ષેત્રની બહાર છે, પરંતુ કેટલીક અગત્યની સુચના (નીચે આપેલ છે) જે તમે પ્લાન્ટના ઓપરેટર અથવા મરમ્મતના કામદાર તરીકે જોખમી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારના ઈલેક્ટ્રીકલ સાધનોની ઈન્ટેગ્રેશને જાળવી શકો છો.



સેન્ચેન્ડ અક્સમાતમાં માર્યા ગયેલાં નું સ્મારક

તમારો શું કરી શકો ?

- ➔ તમારા પ્લાન્ટમાં કરેલા જોખમી વિસ્તાર અને ઈલેક્ટ્રીકલ વર્ગીકરણને સમજો. તમે જો તમારા વિસ્તારનું ઈલેક્ટ્રીકલ વર્ગીકરણનું ચિત્ર જુઓ નહી તો, તેને માટે પુછો અને ખાત્રી કરો કે તે અધ્યતન છે.
- ➔ તમારા પ્લાન્ટમાં જોખમી વિસ્તાર વિશે જાણવા માટે તમારા પ્લાન્ટના ઈલેક્ટ્રીકલ વર્ગીકરણ નિષ્ણાતને બોલાવો. તેમને તમારા કામ દરમિયાન જોવા મળતા ઈલેક્ટ્રીકલ સુરક્ષાની બાબતો અને તેની સમસ્યા વિશે પૂછો.
- ➔ તમારા પ્લાન્ટના સમયાંતરના સુરક્ષા નિરીક્ષણોમાં એકાદ વખત ઈલેક્ટ્રીકલ સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. દા.ત. નુકશાન પામેલા વાયરો અથવા ઈલેક્ટ્રીકલ બોક્સ શોથો. ગાસ્કેટ, સીલ, બંધ જગ્યામાં અપુર્ણી હવાનો પ્રવાહ અથવા ઈલેક્ટ્રીકલ એન્કલોજર ઉપર ખોવાયેલા બોલ્ટથી થતી સમસ્યા શોથો.

- ➔ કોઈપણ ઈલેક્ટ્રીકલ સાધનોને જોખમી વિસ્તારમાં લાવતાં સાવધાની રાખો, જે તમે પોતે લાવો કે તમે વર્ક પરમીટ બીજાને લાવવા દેવા અધિકૃત કરો. કેટલાંક ઉદાહરણો : ઈલેક્ટ્રીક મોટર સાથે કોઈપણ જેમકે પોર્ટબલ પર્મ, પોર્ટબલ સાધનો, ફેલેશ લાઈટ, કોમ્પ્યુનીકેરણના સાધનો, મોટર વીકલ (જેમાં ફોર્ક ટ્રૂક, લીઝન્ટ ટ્રૂક, વિ.) કોઈપણ વસ્તુન જેને ઈલેક્ટ્રીક પ્લગની જરૂર પડે અથવા જેને બેટરીની જરૂર પડે તે વિશે પુછો. બધા સાધનો જેને તમે ચોક્કસ જોખમી વિસ્તારમાં વાપરવાના હોય તે ત્યાં વાપરવા માટે યોગ્ય છે તે વિશે ખાત્રી કરો. તમે ચોક્કસ ન હોય તો જે નિષ્ણાત હોય તેની મદદ લો.
- ➔ ખાત્રી કરો કે જોખમી વિસ્તારના ઈલેક્ટ્રીકલ સુરક્ષા અંગે વ્યવસ્થાના બદલાવ માં આવરી લેવાયો છે.

તમારાં પ્લાન્ટની ઈલેક્ટ્રીકલ સુરક્ષાને સમજો !

AIChE © 2013. All rights reserved. Reproduction for non-commercial, educational purposes is encouraged. However, reproduction for the purpose of resale by anyone other than CCPS is strictly prohibited. Contact us at ccps_beacon@aiche.org or 646-495-1371.